

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૧/૨૦૧૫ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૮/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૧ કેસ કરી ૧૩ વ્યક્તિઓને ઝડપી ૩૭ લીટર દેશી દારૂ, ૧૫૮ બોટલ ઈંગ્લીશ દારૂ. ૧૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ અને ૧૧ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા મુજબ ૦૧ કેસ કરી ૦૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૩૫૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૯/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહિ ૯૩ મુજબ ૧૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

સોનાનો દોરો તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૭૦/૧૫

ચાંદખેડા : શૈલજાબહેન અનત્યારાવ વેન્કટા (રહે.સ્વાગત રેસીડેન્સી, મોટેરા) તા.૮/૧/૧૫ બપોર ૨/૦૦ વાગ્યાના સુમારે મોટેરા ગેટની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૩૦ થી ૩૫ વર્ષના આશરાના) શૈલજાબહેનનાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ શૈલજાબહેન વેન્કટાએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.સી.દેસાઈ ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૭૧/૧૫

ઇસનપુર : ઓમપ્રકાશભાઈ પરશુરામ ચારણ (રહે.સંતોષી એપાર્ટમેન્ટ, જીવણપાર્ક સામે, ઇસનપુર) એ તા.૮/૧/૧૫ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૧/૧૫ રાતનાં ૮/૩૦ થી તા.૮/૧/૧૫ સવારનાં ૮/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના દરવાજાનો નકુચો તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૪૭,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મસઇ.શ્રી કરણસિંહ લક્ષ્મણસિંહ ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૭૨/૧૫

ચાંદખેડા : હિરાબહેન બાબુભાઈ પરમાર (ઉ.વ.૪૦)(રહે.રામાપીરના મંદિર પાછળ, આશારામ આશ્રમ ચાર રસ્તા પાસે, મોટેરા) તા.૮/૧/૧૪ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાયમસ ઉપર પાણી ગરમ કરતાં હતા દરમ્યાન પ્રાયમસમાં ભડકો થતાં, પહેરેલ કપડે આગ લાગતાં, શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન તા.૮/૧/૧૫ સવારનાં ૮/૩૦ તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.સી.દેસાઈ ચલાવે છે.

શહેરકોટડા : પુનમબહેન સોમવીરસિંગ યાદવ (ઉ.વ.૨૪)(રહે.હનુમાન મંદિરની સામે, અનિલ વકિલની ચાલી, પ્રેમનગર) એ તા.૯/૧/૧૪ બપોરના ૩/૪૫ વાગ્યાના સુમારે કોઈ કારણસર પોતાની સાસરીમાં ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી “ડી” ડીવીઝન ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.